

RAN-2401000106020561

B.A. (Non NEP) (Sem. VI) Examination March - 2026 Economics (Paper - 17) Macro Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book.	Seat No.: Student's Signature
--	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો (ગમે તે પાંચ) 10**
- નાણાંની માંગનો પ્રશિષ્ટ અને આધુનિક અર્થશાસ્ત્રીઓનો મત જણાવો.
 - ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો કયા કયા છે?
 - નાણાંનો આવકવેગ એટલે શું?
 - ઉત્પાદનના નીચલા અને ઉપલા તબક્કાઓ એટલે શું?
 - નકારાત્મક મૂડીરોકાણ એટલે શું?
 - વ્યાજના દર અને રોકડ પસંદગી વચ્ચે કેવો સંબંધ છે?
 - નાણાંકીય નીતિના પરિમાણાત્મક સાધનો કયા કયા છે?
- પ્ર.2. વ્યાપારચક્ર એટલે શું? હોટ્ટેનો વ્યાપારચક્રનો સિદ્ધાંત ટીકાત્મક રીતે સમજાવો. 13**
- અથવા**
- પ્ર.2. (અ) નાણાંના પુરવઠાને અસર કરતાં પરિબળો 07**
(બ) વ્યાપારચક્રના લક્ષણો 06
- પ્ર.3. વ્યાજના દરનો ધિરાણ ભંડોળનો સિદ્ધાંત ચર્ચો. 13**
- અથવા**
- પ્ર.3. (અ) નાણાંકીય નીતિ અને આર્થિક વિકાસ 07**
(બ) વિકાસશીલ દેશોમાં રાજકોષીય નીતિની ભૂમિકા 06
- પ્ર.4. ટૂંકનોંધ લખો (ગમે તે બે) 14**
- વ્યાપારચક્રનું નિયંત્રણ
 - વ્યાજના દરનો પ્રશિષ્ટ સિદ્ધાંત
 - રોકડ પસંદગીના હેતુઓ
 - નાણાંકીય નીતિના હેતુઓ

ENGLISH VERSION

- Q.1. Answer the following questions briefly. (Any five)** **10**
- (1) State the classical and modern economists view for demand for money.
 - (2) What are the components of money supply in India?
 - (3) What is income velocity?
 - (4) What are lower and higher stages of production?
 - (5) What is negative investment?
 - (6) What is the relationship between interest rates and liquidity preference?
 - (7) What are the quantitative instruments of monetary policy?
- Q.2. What is trade cycle? Critically explain Hawtrey's theory of trade cycle.** **13**
- OR**
- Q.2. (A) Factors effecting supply of money** **07**
(B) Characteristics of trade cycle **06**
- Q.3. Explain the loanable fund theory of interest rate.** **13**
- OR**
- Q.3. (A) Monetary policy and economic development** **07**
(B) Role of fiscal policy in developing countries **06**
- Q.4. Write short note. (Any two)** **14**
- (1) Control of the trade cycle
 - (2) Classical theory of interest rate
 - (3) Objectives of liquidity preference
 - (4) Objectives of monetary policy
-